

જાહેર ખબર
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,
વિકસતી જાતિ કલ્યાણ,
બ્લોક નં.૪, ત્રીજો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન,ગાંધીનગર.
માનવ ગરીમા યોજના (વર્ષ ૨૦૨૨-૨૩)

નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી- વિમુક્ત જાતિઓના લાભાર્થીઓને સાધનો/ટુલ કીટ્સ પુરા પાડી સ્વરોજગારી આપવાની યોજના અમલમાં છે. જેમાં જુદા-જુદા ધંધાઓ-વ્યવસાયો માટે નિયમોનુસાર સાધન/ટુલ કીટ્સ આપવામાં આવનાર છે.

સદરહું યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારઓ પાસેથી esamajkalyan.gujarat.gov.in પર તા.૧૬/૦૬/૨૦૨૨ થી તા.૩૦/૦૬/૨૦૨૨ સુધી ઓનલાઇનથી અરજીઓ મંગાવવામાં આવે છે.

નાણાકિય વર્ષ ૨૦૨૧-૨૨ની મંજૂર થયેલ અરજીઓની સંખ્યા લક્ષ્યાંક કરતા ખુબજ વધારે હોવાથી, નિર્ધારિત લક્ષ્યાંકની મર્યાદાને ધ્યાનમાં રાખી મંજૂર થયેલ અરજીઓનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવામાં આવેલ. કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં જે અરજીઓ પસંદ થયેલ ન હતી તેવી અરજીઓને અરજદારોના વિશાળ હિતને ધ્યાનમાં લઈ સરકારશ્રી દ્વારા આગામી વર્ષ (૨૦૨૨-૨૩)માં કેરી ફોરવર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવેલ. પરંતુ નિચે દર્શાવેલ જિલ્લાઓમાં લક્ષ્યાંક સામે પુરતા પ્રમાણમાં જાતિવાઇઝ અરજીઓ મળે તે માટે તે જિલ્લાઓમાં સંબંધિત જાતિઓના લોકો ઓનલાઇન અરજી કરી શકશે, જેની ખાસ નોંધ લેવી.

- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે વડોદરા,છોટા ઉદેપુર,ખેડા, નર્મદા,નવસારી,પંચમહાલ, સુરત, તાપી.
 - વિચરતી- વિમુક્ત જાતિ માટે ભરૂચ,બોટાદ,દેવભૂમિ દ્વારકા,ખેડા,પંચમહાલ,પાટણ,સાબરકાંઠા,સુરત
- (૧) માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા માટેની ઓનલાઇન અરજી કરી જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. અધુરી મળેલ અરજી દફતરે કરવામાં આવશે.
- (૨) અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- થી વધુ હોવી જોઈએ નહીં.
- (૩) વિચરતી વિમુક્ત જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતિ માટે આવક મર્યાદાનું ધોરણ લાગુ પડશે નહીં.
- (૪) અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- (૫) અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય ખાતા, એજન્સી કે સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહિ.
- (૬) આ યોજનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે.
- (૭) માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો esamajkalyan.gujarat.gov.in પર દર્શાવેલ છે.જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અરજદારએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી,(વિકસતી જાતિ) ની કચેરીમાંથી પણ મળી રહેશે.
- (૮) માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે.

સ્થળ:- ગાંધીનગર
તા:- ૧૪/૦૬/૨૦૨૨

(એન.એ.નિનામા IAS)
નિયામક
વિકસતી જાતિ કલ્યાણ
ગુજરાત રાજ્ય, ગાંધીનગર